



પ્રેઝન્ટર

હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું 'a recipe for disaster' એટલે 'કંઈક જે આપત્તિમાં પરિણામશે' એના વિશે.

મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતા 'a recipe for disaster' વિશે તમે કેટલું જાણો છો? ડોન્ટ વરી... હું તમને સમજાવું.

ફ્રેફેઈને કેક બનાવતો જોઈ રોબને નવાઈ લાગે છે. મિત્રો, લાગે છે રોબ નથી ઈચ્છતો કે ફ્રેફેઈ કેક બનાવે.

**Rob**

Err, Feifei what are you doing?

**Feifei**

I'm making a cake – a chocolate cake - obviously!

**Rob**

Why are you making a chocolate cake?

**Feifei**

It's Helen's birthday. What's wrong with that Rob?

**Rob**

Well, for a start we are in a radio studio not a kitchen. Also, you've only got five minutes before she arrives – and you're putting salt in the cake mix not sugar.

પ્રેઝન્ટર

તો મિત્રો, ફ્રેફેઈ હેલનનાં જન્મદિવસ નિમિત્તે કેક બનાવી રહી છે. પણ રોબને કેમ લાગે છે કે ફ્રેફેઈનો કેક બનાવવાનો આઈડિયા બરાબર નથી? જાણવા સાંભળતા રહો.

**Feifei**

Ooops!

**Rob**

It's a recipe for disaster!

**Feifei**

A recipe for disaster? No, look, it's a recipe for a chocolate cake, Rob.

**Rob**

That might be – but a recipe for disaster means ‘a combination of things that will, at some point, go wrong and cause harm, damage or in this case, humiliation – in other words it will end in trouble’.

**Feifei**

So the phrase isn't about cooking? Oh dear Rob, this wasn't the recipe I wanted to follow!

**પ્રેઝન્ટર**

મિત્રો, અભિવ્યક્તિ ‘a recipe of disaster’ એ ‘cooking’ એટલે કંઈક રાંધીને બનાવવા વિશે નથી. ‘A recipe’ નો અર્થ થાય છે ‘નુસખો’ અને ‘for’ ને ગુજરાતીમાં કહીશું ‘ને માટે’. ‘Disaster’ એટલે આફત. બીજો અર્થ થાય છે આપત્તિ.

કોઈ વ્યક્તિના વર્તનનાં કારણે જો અપ્રિય ઘટના અથવા અજગતું બનવાની શક્યતા ઊભી થાય ત્યારે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ પરિબળો જ્યારે નકારાત્મક પરિણામો તરફ દોરી જતા હોય તે સંજોગોમાં પણ ‘a recipe for disaster’ ઉપયોગ થાય છે.

તમે ‘a recipe for disaster’ ની સાથે-સાથે ‘a recipe for trouble’ નો પણ ઉપયોગ કરી શકો છો. બન્નેનો અર્થ એક જ છે. ‘A recipe for disaster’ ની વિરોધી અભિવ્યક્તિ છે ‘a recipe for success’, એટલે કોઈ વર્તન અથવા પરિસ્થિતિ જેનાથી સારા પરિણામો આવે.

હજુ કનફ્યુઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ.

**Examples**

*My doctor says drinking too much, not exercising enough, and having a stressful job are a recipe for disaster. He says I might die young!*

*I'm not looking forward to the party. Having my wife and ex-girlfriend in the same room will be a recipe for disaster!*

---

**English Expressions**

bbclearningenglish.com

© British Broadcasting Corporation 2018

Page 2 of 3

*Watch out on the road tonight – all that rain followed by freezing temperatures is a recipe for disaster.*

**Feifei**

So put another way, 'a recipe for disaster' is a phrase that means 'someone's actions will result in things going badly wrong'. So what problem is my cake making going to cause, Rob?

**Rob**

Well can't you see there's cake mix on the table – the cake won't be ready in time – and it'll taste disgusting with all that salt in it.

**Feifei**

Oh calm down – do you want to taste the cake mix?

**Rob**

Oh go on then.... Mmmm, actually it's not too bad. And there's not much mess. Perhaps it's not a disaster – but maybe we shouldn't give it to Helen. Shall we keep it for later?

**Feifei**

Ha ha – it looks like this has been a recipe for success!

**Rob**

For once Feifei, you might be right!

**પ્રેઝન્ટર**

લાગે છે ફ્રેફેઈની વાત સાંભળીને રોબે પોતાના વિચારો બદલી નાખ્યાં છે અને હવે તે કેક બનાવવાનાં આઈડિઆને 'a recipe for success' ગણે છે નહીં કે 'a recipe for disaster'. અને મિત્રો, ચોકલેટ કેક ક્યારેય ખરાબ આઈડિઆ હોઈ શકે?

તમારા વિશે જણાવો મિત્રો? શું તમે ક્યારેય એવી પરિસ્થિતિનો સામનો કર્યો છે જે 'a recipe for disaster' જેવી હતી? અથવા તો શું તમે કંઈક એવું કર્યું છે જે 'a recipe for success' પુરવાર થઈ હોય?

આવા જ બીજા રસપ્રદ ટોપિક્ સાથે ફરીથી મળીશું English Expressionsમાં. ત્યાં સુધી Bye!